

ગાંધીજી

લેખક, પત્રકાર, મુદ્રક અને પ્રકાશક

ગ્રયોગ્યાને સસ્ત્રિમ

હરિજન સેવક

(સ્થળ : ગુરુનાનાંદી)

અધ્યક્ષ - કિલોટન ગુરુનાનાંદી

નાન ૧૫

નાન ૧૫

છાપ નિર્દિશ
બેસને લાલાની રેલવે
સ્ટેશન પુસ્તકાલ, શાંકુર, ગુરુનાનાંદી

બાધમાનાન, વાનિશા, ના. ૧૧ પાલા, ૧૯૪૦

સ્થળ પ્રદાન કરેલું હૈ
સ્થળ કે કે કે કે

પંદરમાં ઘોમસ્ટ

સ્થળ : ગુરુનાનાંદી

હરિજન બિંદુ

(સ્થળ : ગુરુનાનાંદી)

અધ્યક્ષ : ગુરુનાનાંદી

નાન ૧૨

નાન ૧૨

યુનિયન
સ્ટેશન
બેસને લાલાની
રેલવે

અધ્યક્ષ - કિલોટન ના. ૧૨૩૩ પાલા ૧૯૪૦

સ્થળ પ્રદાન કરેલું હૈ
સ્થળ કે કે કે કે

GJ 891.478

fifteenth

Reg. No. 83002

B 222 H

HARIJAN

(FOUNDED BY MAHATMA GANDHI)

Editor : K. G. PASHRUWALA

ନବଶ୍ରୀଵନ

पुस्तक १२]

નાચી: મેળનાથ કરમણે ગાંધી

{ ୩୯ }

अमरावती—संकेत ग्रन्थालय के 12 अप्रैल 1952
संस्कृत एवं शिल्प विभाग

ମୁଦ୍ରଣ

લગ્નાલિંગ અનુભવ	૧૨
અનુભૂતિ ૧૦૮	૧૩
સ્વારી અને વિશુદ્ધ	૧૪
કલેકનો પણ	૧૫
કલેકનો પણ (બાળ)	૧૬
અનુભૂતિ પણ	૧૭
સ્વારી રોક આપો	૧૮
નિષ્ઠાની કામાયારા	૧૯
સ્વારી નિષ્ઠા	૨૦
અનુભૂતિ અનુભૂતિ ગંગો	૨૧
નારી અનીને જોડેથી આપો	૨૨
અનુભૂતિ એના અનુભવ કે	૨૩
અનુભૂતિ વિશુદ્ધ રૂપો	૨૪
અનુભૂતિ ગુરુ-વિશુદ્ધ અને અનુભૂતિ — ૧૩	૨૫

ନାଥ

અનુભૂતિ રાય

वर्षा नामी भूमध्य उपचतुर्वली प्रदति विहुआन
करे नामे तो भेदभै ज्ञाने नामे प्रति इती देख तारे
ज्ञाने सुनो देखो लाल कर्ण प्रदति तिरुवृषभे
ज्ञाने विश्वामी ए र रीते वर्षावै उपचतुर्वली; देख अंगै
उत्तिसवारे आपालने डेहो ज्ञाना औ भाग्यालोगो एवं
ज्ञाना प्रदेशो बोहार्छ के वासालाका वरस रुखा होइ
देखायो पासो येथे तिरुवृषभ ज्ञानो आपालो विश्वामी
ए वर्षावै विश्वामीयो अंगेसें आपालो ज्ञानालो
एवं विश्वामी तिरुवृषभे राजे के बाल जाल ए विश्वामी
वर्षा दु, दो वराहालु राज्य रुखु छ, वापारावैदेहो भेदो
सप्तरी विश्वामी अंगो व्याधानो आपालो विश्वामी दु,

અને એ કરીદના સ્વરૂપ
અનુભૂતિ કેવી રીતે ?

२६ अप्रैल दोपहर ३. अमरावत र उसे लेते व्यक्ति
पाणी परत रहे तो तो उपर उपर उपर आये थे।
विद्युत विद्युत विद्युत विद्युत विद्युत विद्युत विद्युत
थे। वास्तव मात्र विद्युत विद्युत विद्युत विद्युत विद्युत
थे थे! विद्युत विद्युत विद्युत विद्युत विद्युत विद्युत विद्युत

અનુભવ કાળજીએટર્

वर्ष में कई दो वर्षों में यह मैत्री है।

ब्रह्मन् यत् तद् देवं दुर्लभम् ॥
नवि आपये हैर् ये तांसि धैर्यो न विष्णु वाप्ते
मृत्युं पश्य नदि चित्तपी वक्त्रीना अप्यपेक्ष विहि
त देवा एव इत्यत्या माते दुर्लभेन नु पश्यत्

पंचमां व्यापे भासने चिरती बहिनो प्रवृत्ति
परमो देवावाति ५३। शक्ति वारे आगमामरो भासने
शक्ति अने देवेना ठारामाने नाडांना तसेह पंचपदे
मार्ग देण्या वेवी वेवी धनले खाल घरनी राखी

નંબરમાં દિવ્યોત્તમાં પુનર્જ ભરતારે 'રિલે અસ્પેક્ટ' ડાયો દોસે તેથી એવું કાગાપાત્રથીને કુચાણું જઈ શાયા એવા ઉપરાંતો મધ્યમાં દાખરી નાચે છે એવી વૈધી રૂપી

એવી રૂપનું હતું.
‘મારાં દિવલી પ્રારંભ નિષ્ઠાંનેના કો અનુ-
કૃતારેના એ નેત્રાં હો દા તેનું રમણું જ્ઞાન અનુભૂતિ
થિયે રહ્યું હોયના એવું હો ગઈ.

અનુભવમણ એવ અનુભવમણ રિસર્વેશનો બાબતે કથાને
મનજી રોજને રસાયનર કાર્યાલાય રિસર્વેશની અનુભવમણ એવે મેળે
અનુભવમણ રિસર્વેશનું હતું જાહેર.

विष्वासी वाराणसीर, इनिहां पापाखी पक्ष अपने
विष्वासी देश के लोग के जने राज निरुद्धि की है, बिन्दुलालाल
विष्वासी वाराणी वाराणी का वार्षि के बाटी विष्वासी विष्वासी का वार्षि
विष्वासी का वार्षि, पक्ष वाराणसीसी विष्वासी विष्वासी के बाटी
विष्वासी का वार्षि, विष्वासी का वार्षि विष्वासी का वार्षि
विष्वासी का वार्षि विष्वासी का वार्षि विष्वासी का वार्षि
विष्वासी का वार्षि विष्वासी का वार्षि विष्वासी का वार्षि

କ୍ଷାପ୍ତ ନେଷ୍ଟ ମିଳ

પાર્ટીને જિલ્લા વડી ખરાણામણે હંગેસે રાખ્યાં
પાર્ટીને મંત્ર નેતૃત્વ કરે આપણું એકું છે.

ગાંધીજી


લેખક, પત્રકાર, મુદ્રક અને પ્રકાશક

લેખક
અનુ બંધોપાણ્યાચ

અનુવાદક
જિતેન્દ્ર દેસાઈ

નવજીવન પ્રકાશન મંદિર
અમદાવાદ

Gandhiji, Lekhak, Patrakar, Mudrak
and Prakashak – Pen portraits



G.J
891.478
B222 H

© नवज्ञवन द्रस्ट, १९६२

दस रुपिया

पहेली आवृत्ति, प्रत ५००

Library IIAS, Shimla

GJ 891.478 B 222 H



00130454

मुद्रक अने प्रकाशक
जितेन्द्रकाशी डा. देसाई
नवज्ञवन मुद्राणालय,
अमृदावाद - ३८० ०१४

પ્રકારાકનું નિવેદન

મહાદેવ દેસાઈ જનમશતાબ્દી નિમિત્તે નવજીવન અને ગુજરાત વિદ્યાપીઠે ભેગા મળી ગુજરાત વિદ્યાપીઠમાં પત્રકારત્વનો અનુસ્નાતક અલ્યાસક્રમ શરૂ કર્યો તેને લગભગ એક વરસ થયું. આ અલ્યાસક્રમનું એક ધ્યેય ‘ગુજરાતી ભાષાના સાધન દ્વારા ગુજરાતના જીવનમાં ઓતપ્રોત થવા અને એ રીતે હિંદી શુદ્ધ સેવા કરવા ઈરછનારા સહકારી અને ગુજરાતી ભાષાપરાયણ સેવકો દ્વારા લોકશિક્ષણનું કાર્ય કરે તેવા’^૧ નીર, નિષ્ઠાવાન પત્રકારો તૈયાર કરવાનું છે.


આ વર્ગના તાલીમાર્થીઓ નવજીવન મુદ્રણવિદ્યાની પ્રત્યક્ષ તાલીમ પણ લે છે. તેમની લાલ્હીમના ભાગ રૂપે એ ‘તાલીમાર્થીઓએ ભેગા મળી એક નાનકડા પુસ્તક’ ધારીને તૈયાર કરવાનું હોય છે. ‘ગાંધીજી’ — લેખક, પત્રકાર, મુદ્રક અને પ્રકારક ‘પુસ્તક’ ૧૯૫૧ - ૬૨ના વર્ષના તાલીમાર્થીઓએ ભેગા મળી તૈયાર કરેલું ‘પુસ્તક’ છે.

ગાંધીજીએ કેટેટલા વિષય પર લખ્યું છે તેની યાદી કરવા કરતાં ‘તેમણે કયા વિષય પર નથી લખ્યું?’ એવો પ્રશ્ન કરી તેમના લખાણોના વ્યાપનો જ્યાલ આપવાનું સરળ છે. તેવી જ રીતે તેમણે કેટલાં કેટલાં સ્વરૂપે કેવાં કેવાં કામો કર્યા છે તે પણ સંકલિત કરવા જેવું છે. અનુ બંધોપાધ્યાય નામની લેખિકાએ ખાપુનાં આવાં અનેક રૂપોને ઉપસાવતું ‘બહુરૂપી ગાંધી’ નામનું પુસ્તક અંગેજુમાં તૈયાર કરી પ્રસિદ્ધ કરેલું. તેનો ગુજરાતી અનુવાદ નવજીવને પ્રસિદ્ધ કરેલો જે હાલ અપ્રાચ્ય છે. એ પુસ્તકમાંથી ખાપુના લેખક, પત્રકાર તથા મુદ્રક અને પ્રકારક તરફિના રૂપને આ નાનકડા પુસ્તકમાં રજૂ કરવામાં આવ્યું છે. પત્રકારત્વ, લેખન તથા મુદ્રણ અને પ્રકારના કામમાં પહેલા વાચકોને તે વિરોધ ગમશે તેવી આ પુસ્તકની યોજના ઘરી કાઢનાર તાલીમાર્થી પત્રકારોને પૂરી અનુભૂતિ છે.

૧. નવજીવન ફૂસ્ટના ફૂસ્ટ ડિડમાંથી.

MISS JENNIFER

After 1993, Jennifer's personal life took a quiet turn.
Following college, Jennifer started working for a local
non-profit during the late 1990s and again in the 2000s.
During this time, she also began writing fiction, with
her first novel, *Jefferson and the Man Who Would Be King*,
published in 2006.



Jennifer Egan at her desk, circa 2006.


લેખક

ઘણી ચોપડીઓ ઉપર તમને લેખક 'મો.ક.ગાંધી' એમ છાપેલું જેવા મળશે. તેમાંની મોટા ભાગની ચોપડીઓ સણંગ પુસ્તક રૂપે લગાયેલી નથી. આ બધી ચોપડીઓ સત્ય અને અહિંસા, સ્વદેશી, ચરણ વિરોના તેમના લેખો અથવા તો બહેનોને, રાજીવીઓને તથા વિદ્યાર્થીઓને તેમણે આપેલાં ભાષણોમાંથી સંપાદિત કરવામાં આવેલી છે.

ગાંધીજી ખૂબ સારા લેખક હતા. લગ્નવા પાછળનું છોય કાનને સાંભળવી ગમે તેવી છાયાદાર ભાષામાં લગ્નવાનું કે અમુક શૈલીમાં લગ્નવાનું કચોરેય નહોતું. તેમણે એક આગવી અસરકારક શૈલી પીલવી હતી જેમાં તેમની આરાઓ અને અઙ્ગ્રા તથા કુઃખ અને નિરાશાનું પ્રતિબિંબ જોઈ રહકતું. તેમની ભાષા સાદી, સંપદ અને ચોક્કસ હતી. જેમ તેમના જીવનમાં કૃત્રિમતાને સ્થાન નહોતું તેમ જ તેમની ભાષામાં પણ કૃત્રિમતા કચાયે વરતાતી નહોતી.

કેટલાક અંગ્રેજ વાઈસરોઝોએ કબ્બુદ્ધ કર્યું છે કે ગાંધીજી સીધેસીધી વાત કરતા. સુંદર અંગ્રેજું ભાષામાં તેઓ પોતાની વાત રજૂ કરતા અને પોત જ શખ્દો વાપરતા તેના અર્થમાં રહેલી જીણાખર તેઓ ખરાખર સમજતા. તેમના મૌંમાંથી યા તેમની કલમમાંથી વગર વિચારે એક પણ શખ્દ ખહાર આવતો નહોતો એવો તેમનો દાખ્યો હતો. ગોળમેજુ પરિષદમાં ગાંધીજીએ કરેલાં કેટલાક નિવેદનો ઘડવામાં ગાંધીજીને મદદ કરનાર ઓક્સફર્ડ યુનિવર્સિટીના એક અધ્યાપક કર્યું હતું, "ભાષામાં આવતા અવ્યયો પર ગાંધીનો જેટલો કાબૂ છે તેટલો કાબૂ ધરાવતા ખીજ કોઈ હિંદીને ભાગ્યે જ હું મળ્યો હોઈશ.... તેમના ખરડા ઘડવામાં મેં સારી એવી મહેનત ઉડાવી હતી. મિ. ગાંધી મારા ખરડાને ઝડપથી જોઈ જતા અને એકાદ અવ્યયમાં યોગ્ય ફેરફાર કરતા. તે ફેરફારની ધારી અસર થતી અને તેનાથી એ ખરડાનો મારો અર્થ, ગાંધી કરવા માગતા તે અર્થમાં ફેરવાઈ જતો."

કેટલાક પસંદગીના અંગ્રેજ લેખકો અને બાઈબલ માટેના ગાંધીજીના



પ્રેમ અને તેમના કાળજીભર્યો વાંચને તેમના કાનને શાખદોના ચોગ્ય ઉપયોગ મારે કેળવ્યા હતા. તેમનું વાંચન વિરાળ હતું અને તેઓ જેટલું વાંચતા તેએલું પચાવતા પણ ખરા.

તેમની યુવાનીમાં હિંડી વિદ્યાર્થીઓ મારે 'લંડન ગાઈડ' નામની 'પુસ્ટિકા લખવાનો' એક કાચો પ્રયાસ તેમણે કરેલો. એ પુસ્તકમાં લંડન વિરો ઉપયોગી માહિતી આપવામાં આવી હતી. ત્યાર પછી તેમણે બીજુ એ પુસ્તિકાઓ લખી: 'અન અપીલ કુ એવરી બિલ્ન' અને 'ઈન્ડિયન ફેન્ચાઈઝ'. પહેલીમાં નાતાલમાં વસતા હિંડીઓની સામાન્ય સ્થિતિનું ખ્યાન કરવામાં આવ્યું હતું અને બીજીમાં નાતાલમાં હિંડી મતાવિકારનો ઈતિહાસ આપવામાં આવ્યો હતો. ત્યાર પછી 'લીલું ચોપાનિયું' ખાલ પડ્યું, તેની ભાષા હક્કિકતોથી સભર હતી. એક જ મહિનામાં તેની બીજી સુધ્યારેલી આવૃત્તિ ખાલ પડી. આ 'લીલા ચોપાનિયાં'નો સારાંશ દક્ષિણ આદ્ધ્રિકાનાં આખખારોમાં પ્રગત થયો. તે વાંચીને યુરેપિયનો ચિડાયા અને ગાંધીજી ફરી પાછા દક્ષિણ આદ્ધ્રિકા આવ્યા ત્યારે તેમને ઘેરી લેવામાં આવ્યા અને તેમની કસોટી થઈ. તેમને થયેલા આ ગ્રાબ અનુભવ પરથી ગાંધીજીને લાગ્યું કે તેમના લખાણો દૂંકાણમાં ચોગ્ય રીતે ઉતારી શકાય તેવાં નથી હોતાં. તેમની પાસે દૂંકાણમાં લખવાની એક ખાસ આવડત હતી. તેમણે કોંગ્રેસનું બંધારણ ઘડ્યું હતું તથા બીજા ઘણા દરાવોના ખરડા પણ તૈયાર કર્યો હતા.


'ગાઈડ કુ હેલ્થ'માં ગાંધીજીના ઓરાક વિરોના 'પ્રયોગો આલેખવામાં આવ્યા છે. ગુજરાતી 'ઈન્ડિયન ઓપીનિયન'માં 'આરોગ્ય વિરો સામાન્ય જ્ઞાન' એ મથાળા હેઠળ છાપાયેલા તેમના લેખોનું આ અંગેજ ભાષાંતર છે. હિંદમાં અને હિંદ ખાલ તે લેખો ખૂબ પ્રચાર પામ્યા છે. તેનો અંગેજમાં, યુરોપની બીજી ભાષાઓમાં તથા હિંદની પ્રાંતીય ભાષાઓમાં પણ અનુવાદ થયેલો છે.

જ્યારે કોઈ પણ વિચાર તેમના મનમાં દફ થઈને ખરાબર ગોડવાઈ જતો ત્યારે તેઓ તેને વિશ્વાસપૂર્વક લખી નાખતા અને એ લખતી



વખતે કોઈ એની મરકરી તો નહીં કરે ને એવો જરાસરખો પણ ભય તેમને લાગતો નહીં. તેમની લખવાની તીવ્ર ઈચ્છાને કારણે તેઓ ચાલુ ગાડીએ અને મધ્યદરિયે ઉછાળા મારતી સ્વીમરમાં બેસીને પણ ઝડપબેસ લખતા. ૧૮૬૫માં આવું 'લીલું ચોપાનિયું' તેમણે સ્વકેશ જતાં સ્વીમર પર લગ્યું હતું. આધુનિક સંસ્કૃતિનું કંડક વિવેચન કરતું 'હિંદ સ્વરાજ' નામનું પુસ્તક તેમણે ૧૮૦૮માં હંગલંડ્યી દક્ષિણ આદ્ભુતાની મુસાફરી દરમિયાન એકી વારે લગી કાઢયું હતું. તે માટે તેમણે સ્વીમરની સ્ટેશનરીનો ઉપયોગ કર્યો હતો. લખતાં લખતાં જ્યારે તેમનો જમણો હૃથ થકી જતો ત્યારે તેઓ ડાબા હાથે લખતા. આ રીતે તેમણે દરા દિવસમાં આપી ચોપડી લખવાનું કામ પૂરું કર્યું હતું. આ પુસ્તક વાંચીને ગોલ્સ્ટોયે કહ્યું હતું કે "યેસિલ રિઝિસ્ટરન્સનો સવાલ માત્ર હિંદ માટે જ નહીં પરંતુ આપી કુનિયા માટે ગ્રૂપ જ અગત્યનો છે." દેશના ધરતરના કાર્ય માટે 'રચનાત્મક કાર્યક્રમ' નામનું પુસ્તક તેમણે ગાડીમાં મુસાફરી કરતાં કરતાં લગ્યું હતું. તેમના લખાણની હુસ્તાપ્તમાં ઘણા ઘોડા સુધારા કેલા. જોવા મળતા અને તેમાં કંઈ કેરકાર કરવાની જરૂર પણ કર્યારેક જ ઊભી થતી. સત્યના પાલનને આતર, શબ્દનો કોઈ બીજો અર્થ થઈ જય તેમ એમને લાગે, ત્યારે જ તેઓ આવો કેરકાર કરતા.

કોઈ એક વિચારને બીજી ભાષામાં ઉતારવા માટે ચોંચ શબ્દોની પસંદગી કરવાની તેમની પ્રકા અદ્ભુત હતી. અનુવાદ કરતી વખતે વાક્ય યા શબ્દના શાબ્દિક અર્થને તેઓ વળગી રહેતા નહીં. 'દ્ય ડાન્સ'ને તેમણે 'પતંગ નૃત્ય' કહ્યું. ગાંધીજીની જીવી લાગણીઓનો પડધો પાડતું રસ્કિનનું 'અન્દુ ધિસ લાસ્ટ' તેમના હૃદયમાં વસી ગયું અને તેમણે તેનો સાર ગુજરાતીમાં ઉતાર્યો. તેનું નામ 'સર્વોદય' આપવામાં આવ્યું. કાલીઈલના લખાણના કેટલાક ભાગનો તથા કમાલ પારાના જીવનના કેટલાક ભાગનો ગુજરાતી અનુવાદ પણ તેમણે કર્યો હતો. 'એક સત્યવીરની કથા' નામનું પુસ્તક લેટોના 'ઉફેન્સ એન્ડ ડેથ એંડ ચ્યુકેટીસ'નું ગવદમાં કરેલું રંપાંતર જ છે. ગાંધીજી જ્યારે જેલમાં




જ્ઞાન માર્ગાસ્પી અનુભવ તેમાં ઉત્ત્તો કી રહી રહીએ
નેણું હોયિને આપણા ધારીલી ધૂંછું કે દ્યા જરાબોને
માણસાં પાસેથી ફિલ્મ લઈ રહ્યું હોય અને નેથી
આપણું તેમ કરતા આવ્યા હોયે

૧૦. જ્ઞાન તમે બોલો હો ને નમારો વિજ્ઞાન
જ્ઞાન હે મૈન નમારે નથી રહ્યું હું તમારે
કલ્પના હોય પડરો કે ચંગોંને ખોને જે કૃષિ
મેળવું હે તે આજામારો કરોં મેળવું હોય તેમે
ચાઢી ગયા છોકે તેમારો એ મેળવેલું નકટું હોયું
મારે દોડું હે. તોથે મારો દાંદન ને દુંડું વધ્યાં
દુંડુંથી તેમારો એ રહ્યું મંઘતવા ધ્યાન વે
ને મેળવ્યું. માટેના એ હું કુતે ખોટું નોનાની
ધ્યાનું પાર નાડી. સાધન હું હતું તનો રહ્યો
ન્યું હે! આપણું હું રાંસ રાંસ હોય તે આપણું
કુન ગમેને સાધનથી-મારામારું કરીનું નથી.
પાર જાની યે? ચાંદ મારા ધરમાં પોસું લારે
કંઈ કું જાનું નો રેચાર કરીની એ નાં દુંડ
તો ને રાંસ ને મ કરીને કહીનાનો ર હે

તમે કલ્પના કરતા જાહ્યારો છોકે આપુને
અરજ કરતાં કોણ મળ્યું નહોં અને આપણુંને
માળવાનું નથોં. લારે નાં નારીને કુમનારીને

ગાંધીજના ડાબા હાથના અક્ષર



૧૫
૮૪૨૧૯૮
૫૩૨૬૧ ૧૫

દીક્ષા-

“ ધારો હ અનુભવજ
દીક્ષા દી ક કી રહ્યા
ગરૂ કૃત્ત કે કોઈ તેણે
જ જ કરી. અન્ય તેણું
તે કી કોઈ કિ કરે “
કિન્ન ?

અ. શેનું. એનું હો
કૃત્ત અનુભૂતિ ક કરો
માન. નિદેલા તે તોણા
સાચ. આંદે કાંદે હ ક
સર્વાંત્રી ગરોડી દેખા
જાન અની દુનિ ગરો
અન્ય દૂરી. ક સર્વાં
દીક્ષાની મરોડ ગરું હો
અની સાંજ ન અનુભૂતિ હો
કૃત્ત કરી અને પૂર્વ
નિય કરી. ન ક કિન્નો ક
મરોડ ક કીની. માનો

ગાંધીજના જમણા હાથના અસર



હતા ત્યારે તેમણે ‘આશ્રમ ભજનાવલિને અંગેજુમાં ઉતારી હતી તથા હિંદના કેટલાક લક્ષ્યત્વિચ્છોળાં ‘પદોનું અંગેજુમાં ભાષાંતર કર્યું હતું. એ પદોના ભાષાંતરનું નામ છે ‘સૌંસ ફોમ ધિ પ્રીજન’.

તેમની આત્મકથા તેમણે ગુજરાતીમાં લખી હતી. એ લખીને તેમણે સાદી અને સચોપ રૈલી ઊભી કરી. ગુજરાતી ભાષાને તેમણે લોકોની ભાષામાં ફેરસી નાખી. આત્મકથાનો અંગેજુ અનુવાદ ‘ધિ સ્ટોરી ઓફ માય એક્સપેરિમેન્ટસ વિથ ટૂથ’ નામે પ્રસિદ્ધ થયો છે અને ઘણા આગળ પડતા માણસોએ તેને એક સુંદર સાહિત્યકૃતિ તરીકે ઓળખાવ્યો છે. દુનિયાના એક મહાન પુરુષની ચેતનવંતી માનવીય પ્રતિભાને તો તે ખુલ્લી કરે જ છે, પણ સાથે સાથે તેમનાં માતાપિતાનાં, પત્નીનાં અને ભિન્નોનાં તથા નાર્ક્સીય બનાવોનાં શબ્દચિન્તા, તેમાંથી ઊભી થતી જિજ્ઞાસા અને તેમાં વહી લીધિલા શૂયાછવાયા સંવાદો વાચકના રસ્તે જળવી રાખે છે. હિંદની લગભગ બધી ભાષાઓમાં આ પુસ્તક ઊતરી ચૂક્યું છે તથા અંગેજુ, ફેન્ચ, રશિયન, જર્મન, ચીની તથા જપાની ભાષામાં પણ તેના અનુવાદ થયા છે.

તેમનાં બધાં લખાણોમાં સત્ય તથા ઊચાં નૈતિક મૂલ્યો માટેની તેમની તાલાવેલી ભારોભાર જેવા મળે છે. તેમ છતાં એ લાખાણો માણસે કેવી રીતે વર્તવું જોઈએ તેની શુષ્ક નિયમાવલી જેવાં નથી લાગતાં. બાળકો માટે તેમણે ‘બાળપોથી’ તથા નીતિવિષયક ‘નીતિધર્મ’ એમ બે પુસ્તક લખ્યાં છે. બાળકો અમલમાં ન મૂકી શકે તેવા નીતિના પાઠો તેઓ તેમને ભણાવવા માશતા નહોતા. જેલમાંથી આત્રમનાં બાળકોને તેમણે જે પત્રો લખ્યા છે તે વાંચતાં આનંદ આવે તેવા તેમ જ માહિતીથી ભરેલા છે. તેઓ યોકબંધ કાગળ લખતા. એક દિવસમાં પચાસ કાગળો તેઓ પોતાના હાથે લખી શકતા, અને તે પણ લધુલિપિમાં નહીં. તેમનાં લાખાણોનો ઘણો મોટો ભાગ તેમના પત્રોનો છે, જેની સંખ્યા લગભગ એક લાખ જેટલી થવા જય છે.

‘કળાને આતર કળા’માં ગાંધીજી માનતા નહોતા. તેઓ માનતા કુ દોરેક કળા સત્ય પર આધારિત હોવી જોઈએ અને સાહિત્યની



કિંમત પણ તે માણસને ઊંચે ચડાવવામાં મદદ કરે તે પરથી જ અંકળી જોઈએ. કરોડો અર્ધભૂગ્યા લોકોને માટે સરળ ભાષામાં સારી વાતાઓ અને ખળદ હંકનાર કોશિયો અલીલ ગાળો ભૂલી જઈ આનંદથી ગાઈ રહે તેવા ફુલાઓ રચવાની જરૂર છે અમ તેમને લાગ્યું. સાહિત્ય પરિષકમાં તેમણે લેખકોને સવાલ કર્યો હતો કે, “આ હજારો અભુધ લોકોની મહત્વાકાંક્ષાઓ અને અભિલાષાઓ વિશે તમે વિચાર સરાઓ પણ કર્યો છે? આપણે સાહિત્ય મેળે માટે રચીશું? તેમને વાંચી સંભળાવવા માટે મારી પાસે શું છે?” આના નમૂના તરફે તેમણે ઈંગલંડના સામાન્ય માણસો સમજુ રહે તેવી ભાષામાં ડીન કેરે લગેલા ઈશ્વના જીવનચરિત્રનો ઉલ્લેખ કર્યો હતો. ગુજરાતી ‘ઈન્ડિયન ઓપોપીનિયન’માં તેમણે ઘણાં ચાગળ પડતાં સ્વીપુરુષોનાં ટૂંકાં ચરિત્રો લાગ્યાં હતાં. જ્યારે તેમને તેમના માનીતા કિલસ્ક્રિપ્ટ કવિ રાયચંદ્રભાઈનું ચરિત્ર લખવાનું કહેવામાં આવ્યું ત્યારે તેમણે કહું હતું કે, “જો મારે તેમનું ચરિત્ર લખવું હોય તો મારે તેમના ઘરનો તથા તેઓ જે જગ્યાએ રહતા તે જગ્યાનો અભ્યાસ કરવો જોઈએ. તેમના મિત્રોમાં, શાળાના ગોડિયાઓમાં, સગાંઓમાં અને અનુયાયીઓમાં ભળી જવું જોઈએ.” આ કેવ્યાં પણ તેમણે કદ્પનાને નહીં પરતુ સત્યને જ તેમના ધૂવતારકના સ્થાને રાગ્યું હતું.

ગાંધીજી ભારતનાં મહાકાવ્યો તથા રામ, કૃષ્ણ અને મહામદના જીવનમાં આવતા પ્રસંગો, દાખલાઓ અને ખોધનો ઉલ્લેખ કરતા. આનાથી તેમના વિચારો લોકોને ગળે ઉત્તરી જય તેવું પ્રવાહી સ્વરૂપ લઈ લેતા અને તેમને લોકોના હૃદય સુધી પહોંચવાની અદ્ભુત રાક્ષિત મળી રહેતી. ટોળાંશાહી, સેક્ટ ગુંડાળીરી, અસ્પૃષ્યતા જેવાં અનિષ્ટો અને સેક્ટ કપડાંમાં ઢંકાયેલા ગુંડા જેવા પોતાનું જ હિત જોતા કંચેરીઓની અધ્યોગતિને ઉતારી પાડતી તેમની નીડર વાણી ચોટદાર અને દૂરનું જોનારી હતી. “સત્યનો આદર્શ મહિદ અંશે પણ્યમનો વિચાર છે” એવા લોઈ કર્યાના કથના વિરોધમાં ગાંધીજીએ રામાયણ, મહાભારત અને વેદ વરેરમાંથી છિંદમાં સત્યની પૂજા કેરલા જૂના કાળથી થઈ




રહી છે તેના અસંખ્ય દાખલાઓ ટંક્યા હતા. અંગ્રેજ નાગરિક તરીકે લોડ કર્ણે તેમનું નિરાધાર અને લાગણીઓને ઉસેરનાંથી દોષારોપણ કરતું વિધાન પાછું એંચી લેવું જોઈએ એમ પણ તેમણે કહ્યું. એક વખત ગાંધીજીએ પૂછ્યું હતું, “મહમદ અને તેનો શાંતિનો સંદર્ભ કચાં છે? જો મહમદ આજે હિંદમાં આવે તો તેઓ તેમના કહેવાતા અનુયાયીઓને ખુલ્લા પાડી મને સાચા મુસ્લિમ તરીકે સ્વીકારે, જેમ ઈશુ મને સાચા પ્રિસ્ટી તરીકે સ્વીકારે. પણિમાં આજે પ્રિસ્ટી ધર્મ રહ્યો નથી; નહીં તો ત્યાં યુદ્ધ થઈ શકે નહીં.”

ગાંધીજી કહેતા કે, “કબિ તેણે પોતે રચેતી જાહુરી દુનિયામાં જ રહેતો હોય છે.” પરંતુ તેઓ પોતે રેઠિયાના ગુલામ હતા, જે રેઠિયો કોઈક બીજાએ રચ્યો હતો. પરંતુ તેમની કલમની ઘોડી કરામત કારા તેઓ કેવા વિવિધ પ્રકારનાં જીવંત ચિત્રો સર્જી શકૃતા હતા તે તેમનાં લખાળોમાંના ઘણા કુરાઓમાંથી પુરવાર કરી શકાય એમ છે:

“મૈસરૂરમાં એક પ્રાચીન મંદિરના ગોખમાં મેં એક પદ્ધયરની નાની પ્રતિમા જોઈ હતી. તે જાણો મારી સાથે બોલતી હતી. હતી તો એક અર્ધમન્ત્ર સ્વી જ. તે પોતાનું વત્ત્વ ખંખેરીને કામના બાળથી મુક્ત થવા મથતી હતી. એ પરાજિત કામ વીધીકૃપે તેને ચરણે પડેલો હતો. હું એ સ્વીના આખા દેહમાં વેદના, વીધીના ઊંઘની વેદના જોઈ શકતો હતો.”


“અપોરિસસા અને ત્યાંનાં હાડપિંજરો લિસો તમે જાણો છો? જુઓ, એ ભૂજે મરતા દરિદ્ર હાડપિંજરોના પ્રકેરામાં એવા માણસો ‘પાકન્યા’ છે, જેમણે હાડકાંમાંથી, રિંગડાંમાંથી અને ઝ્યામાંથી આશ્રયચક્ષિત કરી દે એવી કલાકૃતિઓ સરજુ છે. તમે ત્યાં જાણો તો જેવા પાણો કે એક દરિદ્રચમાં રિખાતો માણસ પણ નિર્ઝવ રિંગડાં અને ધાતુમાં કેવી રીતે પ્રાણ પૂરી શકે છે. એક કંગાળ કુલારે મારીમાંથી આશ્રયજનક કલાકૃતિ સરજુ છે.”


“જગ્યા નદીને કઢે આવેલી હતી. વૃક્ષલતાઓથી છવાયેલી નાની નાની ટેકરીઓની વચ્ચમાં થઈને નદી વહેતી હતી. નદીનું પાન રેતાળ હતું. તેમાં કાદવ નહોલો. મંચ નદીના ‘પાણીમાં ઊભો કરેલો હતો. મંચની સામે થઈને જે રસ્તો જતો હતો તેની બંને બાજુઓ બાર હિજરથીયે વધુ સ્વીપુરુષોની વિરાસ મેદની સંપૂર્ણ શાંતિથી બેઠી હતી.’’



“વહેલી સવારે મેં મલભારમાં પ્રવેશ કર્યો પરિચિત સ્થળનો આગામ થઈને હું જતો હતો ત્યારે આગલા પ્રવાસ વખતે જોયેલા એક નાયાડીનું મો મારી નજર સામે તરવા લાગ્યું અસ્પૃષ્યનાને લગતી ચર્ચા ચાલતી હતી એવામાં એક તીણો અવાજ સંભળાયો. મારી સાથે વાત કરી રહ્યા હતા તેમણે કહ્યું ‘અમે તમને જીવતોજગતો નાયાડી બતાવીએ.’ જાહેર રસ્તાનો ઉપયોગ કરવાનો તેને અધિકાર નહોટો. ઉધારે પગે નીરવ પગલે તે એતરમાં થઈને જતો હતો. મેં તેને મારી પાસે આવીને વાત કરવા કહ્યું. ધૂજતાં ધૂજતાં તેણે મારી સાથે વાત કરી. મેં તેને કહ્યું કે આ રસ્તો જેવો મારે મારે છે તેવો જ તારે મારે પણ છે. પણ તેણે કહ્યું, ‘એમ બધી રકે જ નાઈ મારાથી જાહેર રસ્તા ઉપર ન ચલાય.’ તમે મને તમારી સાથે હુસીને વાત કરતો અને ગમ્મત કરતો જોશો, પણ તમારે એ પણ જાણ્યું જોઈએ કે આ બધી ગમ્મત અને હસવા. ‘પાછળા પેલા નાયાડીનો ચેલેરો અને તે દર્શય મલભારના મારા પ્રવાસ દરમ્યાન મારી આંખ આગળ રહ્યાં જ કરવાનાં.’

તેમના વિચાર અને ભાષાની સુંદરતાએ આપણા જમાનાના કેટલાક મહાન પુરુષો ઉપર ઊર્ડી અસર કરી હતી.






પત્રકાર

ગાંધીજી હુંલંડ પહોંચ્યા બાદ નિયમિત છાપું વાંચતા થયા. એ વખતે તેમની ઉંમર ઓગણીસ વરસની હતી. હિંદમાં વિદ્યાર્થી અવસ્થામાં તેઓને છાપાં વાંચવાની ટેવ નહોતી. તેઓ સ્વભાવે શરમાળ હતા અને ઘણા લોકો લેગા મળ્યા હોયં ત્યાં ખોલી પણ નહોતા રહ્કતા. એકવીસ વરસની ઉંમરે તેમણે 'ધિ વેજુટેરિયન' નામના અંગેજુ અદવાડિક માટે શાકાહાર, હિંદની ખોરાક અંગેની ટેવો તથા કેટલાક હિંદી તહેવારો વિશે નવ લેખો લાગ્યા હતા. તેમનાં શરૂઆતનાં લાખાણોમાં ગમે તે વિચારને સાકી અને સચોટ ભાષામાં, સમજાવવાની તેમની શક્તિનાં દર્શન થાય છે.

ત્યાર પછી, બે વરસ વીતી ગયા બાદ ગાંધીજીએ પાછું પત્રકારત્વનું કામ ઉપાડ્યું. પછી તો તેમનું અવસાન થયું ત્યાં સુધી તેમની કલમને કચારેય આસામ ન મળ્યો. માત્ર છાપ પાડવા માટે તેઓ કચારેય કંઈ પણ લાખતા નહોતા તથા અતિશયોક્તિને તેઓ કાળજીપૂર્વક દૂર રાખતા. તેમનું ધ્યેય સત્યની સેવા કરવાનું, લોકોને કેળવવાનું તથા તેમના દેશને ઉપયોગી થવાનું હતું.

તેઓ દક્ષિણ આફ્રિકા આવ્યાને ગ્રીજે જ દિવસે અદાલતમાં તેમનું અપમાન કરવામાં આવ્યું. તેમણે એક સ્થાનિક વર્તમાનપત્રમાં એ બનાવની સિલસિલાબંધ હકીકિત પ્રગટ કરી અને રતોરાત પ્રસિદ્ધ મેળવી.

પાંત્રીસ વર્ષની ઉંમરે તેમણે 'ઇન્ડિયન ઓપીનિયન' પોતાને હુસ્તક લીધું. આ પત્ર કારા તેમણે દક્ષિણ આફ્રિકામાં વસ્તા હિંદીઓને એક કર્યો તથા માર્ગદર્શન આપ્યું. અંગેજુની સાથે સાથે જ આ પત્રની ગુજરાતી આવૃત્તિ પણ ડિનિક્સ છાપખાનામાંથી પ્રસિદ્ધ થતી. ગુજરાતી 'ઇન્ડિયન ઓપીનિયન'માં શરીરને કંઈ કંઈ જાતનો તથા કેટલો કેટલો ખોરાક જોઈએ એ વિષય પરની લેખમાળા તથા મહાન ન્યૂપુરખોનાં ચારિત્રો પણ જોવા મળે છે. આ સાંપ્તાહિકોના દરેક અંકમાં ગાંધીજીના



લાગો આવતા. એ પંચોના બીજા તંની હતા ખરા, પરંતુ તેના કામનો ખથો બોણે ગાંધીજી જ ઉપાડી કેટા હતા. તેમની ઈચ્છા એ પંચોની મદદથી લોકમત કેળવવાની, ગોરાઓ તથા હિંદીઓ વરચે જે જેરસમજો પ્રવર્તતી હતી તેનાં કારણો દૂર કરવાની, તથા પોતાના દેશભાંધવોની કૃષીઓ તરફ તેમનું ધ્યાન દેસરવાની હતી. દક્ષિણ આદ્ધિકાના સત્યાગ્રહની લડતનો વિગતવાર અહેવાલ તેમણે 'ઈન્ડિયન ઓપીનિયન'માં પ્રસિદ્ધ કર્યો. આ કામમાં તેમણે પોતાનું ડિલ રેડચું તેમનાં આ લખાણો પરથી પરદેશમાં વસતા વાચકો દક્ષિણ આદ્ધિકામાં જે કંઈ બની રહ્યું હતું તેનું સાચું ચિત્ર મેળ્યું શકતા. એ લખાણોના નોંધવા લાયક વાચકોમાં હિંદમાં ગોખલે, હંગલંડમાં દાદાભાઈ નવરોજુ અને રશિયામાં ટોલ્સ્ટોયનું નામ ગણ્યાંથી શકાય. દસ વરસ સુધી આ અફવાડિક પત્ર માટે ગાંધીજીએ ભારે જહેમત ઉઠાવી. 'ઈન્ડિયન ઓપીનિયન'ના બદલામાં દર અફવાડિયે તેમને બસો સામયિકો મળતાં. આ બસોએ બસો સામયિકોને તેઓ ધ્યાનથી વાંચી જતા તથા તેમાંથી પોતાના અફવાડિકના વાચકોને ઉપયોગી થઈ પડે તેવા સમાચારોને તેઓ 'ઈન્ડિયન ઓપીનિયન'માં ઉતારતા.

વિચારોને ડેલાવવા માટે વર્તમાનપત્રો ખૂબ જ અસરકારક માધ્યમ બની રહે તેમ છે એ ગાંધીજી જાણતા હતા. તેઓ એક સંકળ પત્રકાર હતા પરંતુ પત્રકારત્વમાંથી પોતાનો રોકલો રણી લેવાનું તો તેમણે કચારેય વિચાર્યું સુધ્યાં નહોંતું. તેમના મત પ્રમાણે પત્રકારત્વનું ધ્યેય સેવાનું હોંનું જોઈએ:

"સ્વાધી હેતુઓ માટે અથવા જીવનનિર્બંધ માટે પત્રકારત્વનો દુરુપયોગ કદાપિ ન થવો જોઈએ. તંનીઓએ કે છાપાંઓએ ગમે તે થાય તોપણ, પરિશામોની પરખા કર્યા સિવાય, દેશહિન માટેના પોતાના વિચારો રજૂ કરવા જોઈએ. જે તેમણે લોકોના હદ્ય સુધી પણોચ્ચવું હોય તો તેમણે જુદી નીતિ અપનાવવી જ રહી."


જે વખતે તેમણે 'ઈન્ડિયન ઓપીનિયન' પોતાને હસ્તક લીધું ત્યારે ન ગોઈમાં ચાલતું હતું તથા તેનો ડેલાવો ચારસો નકલોનો હતો. થોડા મહિનાઓ સુધી તેને ચલાવવા માટે દર મહિને ખારસો રિપિયા જેટલી



મદદ ગાંધીજીને આપવી પડી. તેને મારે તેમને કુલ્લો છબ્બીસ હજાર રૂપિયાની અંગત ઓટ સહન કરવી પડી. આવી મોટી પોઠ આવતી હોવા થતાં તેમણે પોતાના વિચારોને રજૂ કરવા મારે વધ્યારે જરૂર મળી રહે તેટલા મારે, બધી જહેરખખર લેવાનું બંધ કરવું એમ પાછળથી નક્કી કર્યું. જો તેઓ જહેરખખર લેવાનું રાખરો તો સત્યની સેવા નહીં કરી શકે તથા સ્વતંત્ર નહીં રહી શકે એ તેઓ જાણતા હતા. અયોગ્ય સાધનો કારા પોતાના અઠવાડિકનું વેચાણ વધારવાનો તથા બીજાં છાપાંઓ સાથે હરીકાઈ કરવાનો તેમણે કચારોય વિચાર સરખો પણ કર્યો નહોતો.


હિંદુસ્તાનમાં પણ તેઓ તેમની પ્રણાલિકાને વળણી રહ્યા અને ચીસ વરસ સુધી કોઈ પણ જતની જહેરખખર લીધા વગર તેમણે પોતાનાં સામચિકો ખહુાર પાડ્યાં. જહેરખખર અંગો તેમનું એવું સૂચન હતું કે દુરેક પ્રાંતમાં જહેરખખર આપનાં એક જ સામચિક હોવું જોઈએ અને તેમાં લોકોને ઉપયોગી એવી વસ્તુઓનું વર્ણન સારી ભાષામાં આપવું જોઈએ. તેમણે 'યંગ ઈન્ડિયા'ના તર્ણીપદનો સ્વીકાર કર્યો બાદ, એક ગુજરાતી ભાષાના પત્રની ઓટ વરતાતી હતી. તે ઓટ પૂરવા મારે એક ગુજરાતી પત્ર શરૂ કરવા તેઓ આતુર હતા. અંગ્રેજુ ભાષામાં પત્રનું સંપાદન કરવામાં તેમને ખહુ આનંદ આવતો હતો એમ નહોતું. તેમણે 'યંગ ઈન્ડિયા'ની ગુજરાતી તથા હિંડી આવૃત્તિ તરીકે ગુજરાતી તથા હિંડીમાં 'નવજીવન' પ્રસિદ્ધ કરવા માંડચું. આ પત્રોમાં તેઓ નિયમિત રીતે ઘણા લેખ્યો લખતા. ઐફ્ફૂતો અને મજૂરો એ હિંદના ખરા ઘડવૈયા છે. 'નવજીવન'ના ઘણા વાગ્યકો આવા ઐફ્ફૂતો તથા મજૂરો હતા એ મારે ગાંધીજી જૌરવ લેતા હતા.

આ પત્રો મારે તેમને ઘણણું લખવું પડતું. કામનું દબાણ એટલું બધું રહેતું કે મોડી રાત સુધી જાળીને યા તો વહેલી સવારે ઊઠીને તેમને લેખ્યો લખતાનું કામ કરવું પડતું. પ્રવાસમાં ઘણી વખત તેઓ ગાડી ચાલતી હોય તે વખતે પણ લખતા. તેમનાં તેટલાંક જાળીતાં નિવેદનો અને અગ્રલેખોની નીચે ચાલુ ગાડીએ તે લખ્યાં છે એવી



નોંધ જેવા મળે છે. તેમનો જમણો હાથ થાકી જતો ત્યારે તેઓ ડાખા હુંયે લગવા માંડતા. તેમના ડાખા હુંથના અક્ષરો વિશુસ્પષ્ટ હતા. લાંબી માંદળીમાંથી ઉઠચા બાદના આરામના દિવસોમાં પણ, તેમણે અઠવાડિયે નૃણાથી ચાર લેણો લગ્યા છે.

હિંદમાં તેમણે કોઈ પણ સામચિક ખોટમાં ચલાયું નથી. તેમના અંગેજુ અને હિંદની ભાષામાં પ્રસિદ્ધ થતાં સામચિકોનો કેલાવો, ચાળીસ હજાર નકલ સુધી પહોંચ્યો હતો. તેમને જેલમાં પૂર્વવામાં આવ્યા ત્યારે આ કેલાવો ઘરીને નૃણ હજાર પર આવી ગયો. હિંદમાં તેમને પહેલી વાર જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા ત્યાર ખાદ તેમનાં અઠવાડિકોમાં એક નવી લેખમાળા શરૂ થઈ. આ લેખમાળા તે તેમની આત્મકથા. તે નૃણ વરસ સુધી ચાલી અને તેણે કુનિયાભરના વાચકોમાં રસ પેઢા કર્યો. લગભગ બધાં જ હિંદી પત્રોને તેમણે તેમની જીવનકથા તેમનાં પત્રોમાં છાપતા રહેવાની રજ આપી. તેઓ જેલમાં હતા ત્યારે તેમણે ‘હરિજન’ નામે બીજું અઠવાડિક શરૂ કર્યું. ‘યંગ ઈન્જિયા’ની જેમ તેની કિમત પણ એક આનો રાખવામાં આવી. આ પત્ર મુખ્યત્વે અસ્પૃશ્યોની સેવાને વરેલું હતું. વરસો સુધી તેમાં રાજકારણ ઉપર એક્સ્પીય લેખ પ્રસિદ્ધ નહોતો થયો. સૌથી પહેલાં તે હિંદી ભાષામાં પ્રસિદ્ધ કરવામાં આવ્યું. ગાંધીજી જેલમાં હતા ત્યારે તેમને અઠવાડિયે નૃણ વખત લખવાની છૂટ આપવામાં આવી હતી. આ પત્રની અંગેજુ આવૃત્તિ કાઢવાના પ્રસ્તાવ અંગે તેમણે તેમના ભિત્રને લાય્યું કે “અંગેજુ આવૃત્તિ જે વ્યવસ્થિત રીતે ન કાઢવામાં આવે, તેમાં વાંચવાલાએક સામની ન આપી રાકાય અને ચોક્કસ અનુવાદ ન આપી રાકાય, તો તે ન કાઢવી એવી મારી ચેતવણી છે. ગમે તેમ સંપાડિત કેરલું અંગેજુ અઠવાડિક પ્રસિદ્ધ કરવા કરતાં હિંદી આવૃત્તિથી સંતોષ માનવો વિશુસ્પષ્ટ થરો. તેને સ્વાવલંબી બનાવી રાકાય તો જ હું તેનું સંચાલન હાથ ‘ધરીશ.’” શરૂઆતમાં નૃણ મહિના સુધી ઇસ હજાર નકલ કાઢતા રહી તેને પ્રયોગ તરીકે ચલાવી જોવાનું તેમણે સૂચન કર્યું. બે મહિના, જેટલા સમયમાં તે પગભર થઈ ગયું, પાછળથી તે ખૂબ જ લોકપ્રિય




વિચારપત્ર બન્યું. લોકો માટે આનંદ આતર નહીં પણ તેમાંથી સૂચનાઓ મેળવવા માટે તેને વાંચતા. તે અંગેજુ, હિંદી, તામિલ, તેલુગુ, ઉડિયા, મરાઠી, ગુજરાતી, કાન્ડી તથા બંગાળી ભાષામાં પ્રસિદ્ધ થતું ગાંધીજી હિંદી, ઉર્દૂ, ગુજરાતી તથા અંગેજુમાં લેખો લગતા.

ગાંધીજીનાં સામચિકોમાં સનસનાઈવાળા વિષયોને મુદ્દલ સ્થાન નહોંતું. સહેજ પણ થાકુચા વગર તેઓ રચનાત્મક કાર્યક્રમ, સત્યાગ્રહ, અહિંસા, ખોરાક, નિસર્ગપચાર, કોમી એકતા, અસ્પૃશ્યતા, કાંતણા, ખાદી, સ્વદેશી, ગ્રામોધ્યાં તથા દાઢખંધી ઉપર લેખો લગતા. તેઓ કેળવણી તથા પોરાણી ટેવોને સુધારી તેની પુનર્સ્યના કરવાની જરૂરિયાત પર ભાર મૂક્તા. આપણી રાખ્યી ખામીઓના તેઓ અંગ ટેકાકાર હતા.

કામ લેવાની ખાખતમાં તેઓ ખૂબ કદક હતા. તેમના અંગત મંત્રી શ્રી મહાદેવભાઈ દેસાઈ રેલવેના ડાયમાં ગિરદી હોય એટલે કામ કરી રહ્યતા નહીં. એટલે તેમને ગાડીના ડાયમાના જાજરમાં આશ્ય લેવો પડતો અને કામ સમયસર પૂરું કરવું પડતું. ગાંધીજી મુસાક્રીમાં હોય ત્યારે તેમનાં પત્રો માટેનું લાખાણ ટપાલ દ્વારા સમયસર પહોંચાડવા માટે લાગુ પડતાં સ્ટેશનોના સમય તથા ત્યાંથી ટપાલ કચાર કચાર નીકળે છે, તેની જાણકારી તેમના મદદનીશોંચે રાખવી પડતી. એક વખત ગાંધીજી જે ગાડીમાં મુસાક્રી કરતા હતા તે મોડી થવાને કારણે મુસાક્રી દરમ્યાન તેમણે લાખી રાખેલો લેખ પહોંચાડવા માટે ટપાલનો સમય રહ્યો નહીં. ખાસ માણસ દ્વારા અંગેજુ લેખો મુંખઈ મોકલવામાં આવ્યા. અને તેનું છાપકામ અમદાવાદના તેમના છાપણાનામાં ન કરતાં મુંખઈ કરાવી લેવામાં આવ્યું. એક સમયસર બહાર પાડવામાં આવ્યો..

‘ઘંગ ઈન્ડિયા’માં નિર્ભયપણે લેખો લગવા બદ્દલ ગાંધીજીને છિંદમાં પહેલી વખત જેલની સજ કરવામાં આવી. સરકાર તરફથી બહાર પડતા હુકમ સામે તેમણે કચારેય નમતું જોગયું નહીં. જ્યારે તેમના અંતરના અવાજને લેખો દ્વારા વ્યક્ત કરવાની બંધી કરવામાં આવી ત્યારે તેમણે લખવાનું બંધ કર્યું. સમય આવ્યે તેમણે લખેલા લેખોની નકલ કરાવી તેને પ્રચારમાં મૂકવાનું કામ કરવાની વાત તેઓ તેમના



વાચકોને ગણે ઉતારી રક્ષણે એ અંગે તેમને પૂર્ણ વિશ્વાસ હતો. તેમના છાપાને દબાવી દઈ રક્ષણે પરંતુ તેઓ જીવતા રહે ત્યાં સુધી તેમના સંકિરણને કોઈ દબાવી રક્ષણે નહીં, એ તેઓ જાળતા હતા. છાપકામનાં બીબાં ગોઢવવાનાં સાધન અને છાપખાનું તેમની પાસે ન હોય તો તેની પરવા કર્યા વગર, તેવે સમયે હુણે લાખેલી પત્રિકાઓ એ વીરયુગના વીરત્વભર્યો ઈલાજ તરીકે કામ કરશે એવી તેમજે ખાતરી આપી હતી.

સરકારી હુકમને પડકારવા માટે ૧૯૯૮માં ગાંધીજીએ ‘સત્યાગ્રહ’ નામે એક સરકારી નોંધણી કરાવ્યા વગરનું સાંપ્તાંહિક બદાર પાડચું હતું. એક પાનાની આ અઠવાડિકની નકલ પૈસે પૈસે વેચાતી.

ઘણાં વરસોના પોતાના અનુભવ બાદ, સારા પત્રકારત્વની કાર્યપદ્ધતિ કેવી હોવી જોઈએ તે અંગે તેઓ લાગે છે :

“છાપાંવાળાઓ હુલતાચાલતા રોગચાળા જેવા બની ગયા છે. લોકો માટે છાપાંઓ બાઈબલ, કુરાન અને ગીતા એ બધાંનું સ્થાન લેવા લાગ્યાં છે. એક છાપું એવી આગામી કરે કે હુલદો થવાની તૈયારીમાં છે. અને ડિલ્હીમાં દુકાનોમાંથી બધી લાકીઓ અને છરીઓ ઊપડી ગઈ છે. છાપાંવાળાનું કામ તો લોકોને ‘બહાદુર’ ભનતાં શીખવાનું છે, તેમનામાં ગભરાઈ દેલાવવાનું નથી.”



મુદ્રક અને પ્રકાશક

‘ઈન્ડિયન ઓપીનિયન’, ‘ચંગ ઈન્ડિયા’, ‘નવજીવન’ અને ‘હરિજન’ એ ચાર પત્રોના ગાંધીજી તંત્રી હતા. આ ચાર પત્રોને તેઓ પોતાના જ છાપખાનામાં છાપીને પ્રસિદ્ધ કરતા. તેમનાં એ પત્રો કોઈ બીજાની માલિકીના છાપખાનામાં છાપવાનાં હોય તો તેઓ પોતાના વિચારો મુક્તપણે વ્યક્ત ન કરી શકે એ તેઓ જાણતા હતા. તેમણે ‘ઈન્ડિયન ઓપીનિયન’ નામના સાપ્તાહિકનો વર્ષીવટ પોતાના હુથમાં લીધો ત્યારે તે ખોટ કરતું હતું. તેમની ઈરથા એ છાપખાનાને શહેરમાંથી અસેડીને કુઠીક ફૂર્ની જગ્યાએ ક્રિનિક્સ આશ્રમમાં લઈ જવાની હતી. તેમના ભિત્રોનું માનવું હતું કે આ પગલું નિષ્ઠળ જરો. ગાંધીજીએ છાપખાનાને ક્રિનિક્સ આશ્રમ અસેડચું અને ત્યાં આગળ એક છાપદું બાંધી છાપખાનાનું યંત્ર તથા બીજું સાધનસામગ્રી વ્યવસ્થિત રીતે ગોઠવાકાવી. આ છાપખાનાનું ચલાવવા માટે એક જૂનું ઓર્ઝિલ એન્જિન રાખવામાં આવ્યું હતું. તેમના દક્કાતર માટે તેમણે જુદ્દો ઓરડો રાખ્યો હતો. આ છાપખાનામાં એક પણ પગારદાર નોકર કે પગાવાળો રાખવામાં આવ્યો નહોતો. ‘ઈન્ડિયન ઓપીનિયન’ દર શનિવારે રહાના કરવામાં આવતું. શુક્કવારની બપોર સુધીમાં બધા લેખોનાં બીખાં ગોઠવવાનું કામ પડું થઈ જતું. છાપાને છાપવા માટે બીખાં ગોઠવવાના, તેને છાપવાના, કાપવાના, વાળવાના તથા તેના પર સરનામાં ચોડી તેના બંડલ બાંધવાના કામમાં નાનામોટા સૌ આશ્રમવાસીઓ મદદ કરતા. આ બંડલો સમયસર રેલવે સ્ટેશન પર પહોંચી જય તે તેમણે જોવું પડતું. તેઓ સામાન્ય રીતે મધ્રાત સુધી કામ કરતા. જ્યારે કામનું ડબાણ વધારે હોય ત્યારે તો ગાંધીજી અને બીજાઓને શુક્કવારની આગ્યી રાત જગવું પડતું. કસ્તૂરભા તથા બીજું આશ્રમવાસી બહેનો પણ કેટલીક વાર આ કામમાં મદદ કરતી.

ઈન્ડિયન ઓપીનિયનને ક્રિનિક્સમાં છાપવાની શરૂઆત કરી ત્યારે પહેલી જ રાત્રે ઓર્ઝિલ એન્જિન રિસાયું, એરલે ગાંધીજી તથા બીજા સરશક્ત આશ્રમવાસીઓએ હોયે ચક્કર કેરવતા રહીને છાપવાનું મરીન ચલાવ્યું અને એ અંક સમયસર બહાર પાડ્યો. આ વ્યવસ્થાથી ગાંધીજીને




છાપકામની નાની નાની જીણવટ શીખવામાં મદદ મળી ગઈ. ગાંધીજી લેખો લખતા, છાપવા માટે બીખાં ગોઠવવાનું કામ કરતા તથા તેનાં પૂર્ક પણ વાંચતા. ઘણા જુવાનિયાઓ આ છાપખાનામાં તાલીમાથી તરીકે કામ કરતા હતા. એક વખત 'ઇન્ડિયન ઓપીનિયન'નો એક અંક માત્ર જુવાન છોકરાઓએ મોટેરાઓની મદદ વગર છાપીને પ્રસિદ્ધ કર્યો હતો. શરૂઆતમાં 'ઇન્ડિયન ઓપીનિયન' અંગેજુ, ડિંદી, ગુજરાતી તથા તામિલ એમ ચાર ભાષામાં છાપાતું હતું. બીજુ ભાષાના તંત્રીઓ અને બીખાં ગોઠવનારાઓના અભાવે પાછળથી તે માત્ર અંગેજુ અને ગુજરાતી એ બે ભાષામાં જ નીકળતું. ગાંધીજી હિંદ આવીને અધારની મુલાકાતે ગયા ત્યારે તેમણે એક નિષ્ણાતની કેળવાયેલી આંઝે ત્યાં ચાલતા છાપખાનાની જુદી જુદી કિયાનું નિરીક્ષણ કર્યું તેની એની બેસરે નોંધ લીધી હતી.

કિનિક્સના પ્રેસમાં તથા નવજીવન પ્રેસમાં અઠવાડિકોના છાપકામ ઉપરાંત અંગેજુ, ડિંદી અને બીજુ ભાષાઓમાં પુસ્તકોનું છાપકામ પણ થતું. ગાંધીજીએ કચારેય સરકારમાં કોઈ પણ જાતની જમીનગીરી ભરી નહોંતી. તેમનાં પોતાનાં લખાણોમાંથી થતો નકો મુખ્યત્વે આદીકામ માટે વાપરવામાં આવતો. તેમણે એક લાખ રૂપિયા જેટલી રકમનું નવજીવન પ્રેસનું ટ્રસ્ટડીડ બનાવ્યું હતું.

અરાધ્ય છાપકામને તેઓ હિસાનું કામ ગણીતા. સ્વરચ્છ છાપાઈ, એકાઉ કાગળ તથા સાડા અને વ્યવસ્થિત પૂછનો તેઓ આગ્રહ રાખતા. હિંદ જેવા ગરીબ દેશમાં આકર્ષક પૂર્ણવાળી મૌંધી ચોપડીઓ સામાન્ય વાચકને પરવર્તી ન રખે એ તેઓ જાળીતા હતા. તેમના જીવનકાળ દરમ્યાન નવજીવન મુદ્રણાલયે સસ્તી કિંમતનાં ઘણાં પુસ્તકો બહાર પાડવાં હતાં. તેમની ગુજરાતી 'આત્મકથા'ની કિંમત બાર આના રાખવામાં આવી હતી. આ જ પુસ્તકની દેવનાગરી લિપિમાં છાપેલી સસ્તી આવૃત્તિ પણ બહાર પાડવામાં આવી હતી.


જે હિંદમાં માત્ર એક જ લિપિનું ચલણ રાખવામાં આવે તો વાચક અને મુદ્રકનો ઘણો સમય તથા મહેનત બચાવી શકાય. તેટલા



માટે ગાંધીજી દેશભરમાં એક જ લિપિનું ચલણ રાખવાની જરૂરિયાત તથા કાયદા પર ભાર મૂક્તા હતા. હિંદની લગભગ બધી ભાષાઓ સંસ્કૃતમાંથી ઉત્તરી આવેલી હોવાથી આવી સામાન્ય લિપિ તરફ તેમણે દેવનાગરી લિપિને પસંદગી આપી હતી. 'ઈન્ડિયન ઓપીનિયન'ની ગુજરાતી આવૃત્તિમાં તુલસીરામાયણનું એક પાનું ભરીને વર્ણન છાપવામાં આવ્યું છે તે દેવનાગરી લિપિમાં છે. 'હરિજન' પત્ર માટેના ટાઈપ ગાંધીજીએ જાતે પસંદ કર્યો હતા.

તેઓ કોપીરાઇટમાં માનતા નહોતા. તેમનાં સામચિકોમાં આવેલા કંપો આમજનતાની માલિકીના છે એમ તેઓ માનતા હતા. જ્યારે તેમનાં લાખાણોને વિકૃત કરીને રજૂ કરવાની શક્યતા ઊભી થઈ ત્યારે જ તેઓ કોપીરાઇટના નિયમોને અમલમાં મૂકવા માટે સંમત થયા.


બાળકો માટેની ચોપડીઓ મોટાં બીખાંમાં, સારા કાગળ પર છાપેલી તથા વિષયને અનુરૂપ ચિત્રોવાળી હોવી જોઈએ એવું તેઓ માનતા. પાતળી ચોપડીઓ તેઓ વધુ પસંદ કરતા. આવી ચોપડી વાંચતાં બાળકો થાકી જતાં નથી તથા તે પકડવામાં પણ વધુ અનુકૂળ રહે છે. રાખ્યીય શિક્ષણનું કામ સંભાળતા એક આશ્રમવાસીએ એક વાર એક 'ચાલણગાડી' નામે બાળપોથી પ્રસિદ્ધ કરી. આ બાળપોથી આર્ટ પેપર પર છાપેલી હતી અને તેના દરેક પાના પર રંગીન ચિત્રો હતાં. આ ચોપડી તૈયાર કર્યાના ગૌરવ સાથે તેમણે પૂછ્યાં, "બાપુજી, તમે 'ચાલણગાડી' જોઈ? એની યોજના મેં કરી છે." ગાંધીજીએ કહ્યું, "હા, તે સુંદર છે પણ તમે એ કોને માટે પ્રસિદ્ધ કરી છો? પાંચ આનાની ચોપડી ખરીદવાનું કેટલા વાચ્યકોને પોસારો? હિંદની કરોડોની ગરીબ પ્રજાનાં બાળકોનું શિક્ષણ તમારે હસ્તક છે. જો બીજી ચોપડીઓ એક આને વેચાતી હોય તો તમારી ચોપડીની કિમત બે પેસા હોવી જોઈએ." ગાંધીજીએ એક વખત એક અઠવાડિકનું કામકાજ પોતાને હસ્તક લીધું હતું અને તેની એક નકલની કિમત બે આના પરથી ધરડિને એક આનો કરી આપી હતી.



શાપકામમાં પૈસાની બચત કરવી એ ગાંધીજીને મન છેવઈની વાત નહોતી. એક વરણ નવજીવન મુદ્રણાલયે ગોખલેનાં લેગ્ઝો અને ભાષણોનો ગુજરાતી અનુવાદ પ્રસિદ્ધ કરવાનું નક્કી કર્યું. એક કેળવણીકારે તેના અનુવાદનું કામ કર્યું હતું. ચોપડી છપાઈને તૈયાર થઈ ગઈ ત્યારે ગાંધીજીને તેની પ્રસ્તાવના લખી આપવા મારે વિનંતી કરવામાં આવી. ગાંધીજીને અનુવાદ નબળો તથા વાંચવામાં અધરો લાગ્યો. તેમણે તે રદ કરવાની સૂચના આપી. તેના શાપકામ પાછળ સાતસો રૂપિયાનું ખર્ચ થઈ ગયું છે એમ તેમને જણાવવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું, “હવે તેને બાંધવાનો તથા પૂકું ચોટાડવાનો વધારાનો ખર્ચ કરી આ નકામો અનુવાદ લોકો સામે મૂક્યો તમને યોગ્ય લાગે છે? હલકું સાહિત્ય લોકો સમક્ષ મૂકી લોકોની વાંચન માટેની અભિગ્રદિષ્ટ બગાડવાની મારી ઠિકા નથી.” એ પુસ્તકનાં છપાયેલાં ખંડાં પાણાં પરસ્તીમાં પણ ન વેચતાં બાળી મૂક્યવામાં આવ્યાં હતાં.

અગભારી સ્વાતંત્ર્યનો ગાંધીજી હુમેશ બચાવ કરતાં જ્યારે કોઈ પણ સરકારી હુકમે અગત્યની ગણાય તેવી બાધતો વિરો તેમના મંત્ર્યને મુક્તાપણો વ્યક્ત કરતાં તેમને રોકચા ત્યારે તેમણે તેમના પત્રો શાપવાનું બંધ કર્યું. લેખનસ્વાતંત્ર્ય માટેના તેમના પ્રેમને કારણે તેમના શાપખાનાને જપ્ત કરવામાં આવ્યું હતું અને તેમની ફાઈલો બાળી મૂક્યવામાં આવી હતી. તેમને તથા તેમના સાથીદારોને જેલમાં પૂરવામાં આવ્યા હતા. આનાથી તેઓ કચારેય નાહિંમત થયા નહોતા અને તેમણે કહ્યું હતું:

“ચંદ્રો અને બીજાં વિશેના આપણા ઘણાલને ભૂલી જાઓ. કલમ એ આપણનું યાઈપ બનાવવાનું કારણાનું છે અને નકલ કરનારાઓના હાથ આપણનું શાપખાનું છે. દરેક જાણ પોતે હરતુંકરતું છાપું બની જય અને વાતચીત દ્રારા સમાચાર એક જગ્યાએથી બિજુ જગ્યાએ પડોયાડે. કોઈ સરકાર એને દબાવી રાકે તેમ નથી.”



Twelve Pages Reg. No. B. 1822

The Fourfold Curse

Subscription	Single copy Rs. 2
	One year Rs. 5
	Six months Rs. 3
	Foreign Rs. 7. 12s., \$ 3

Young India**A Weekly Journal**

Vol. XII

Ahmedabad: Wednesday, March 12, 1930

Edited by M. K. Gandhi

No. 11

Sardar Vallabhbhai Patel

Sardar Vallabhbhai is the one man who has been responsible for keeping the peace in Gujarat during these troublous times. He is the man whose strict administration of the Ahmedabad Municipal Board drew unstinted praise from the Government. He is the man whose tireless energy put heart into the flood-stricken people of Gujarat in 1927 and when the Government machinery had broken down, his valiant efforts were responsible for saving the lives of thousands of people. It was Vallabhbhai Patel who wiped a potential war in Bundi the other day resulting in a settlement honourable to both the parties. This man of rare, this idol of the Untouchables, their uncrowned king is now a phenomenon disregarding a no less turbulent speech when there was not even in the remotest danger of breach of the peace. He had not gone, the authorities knew, for disobeying the provisions of the Salt Act. He had gone simply to prepare for my march. He had to be removed somehow or other. The Viceroy is going for my contemplated breach of the law. What is to be said of this act of encroaching and abusing the law, interfering with a man's liberty in the name of the law?

And where is Sardar living now? He is in a common cell, unable to sleep in the dark and without any light. He is given food which may affect dysentery to which he is prone. He may not receive any but religious books. As a Satyagrahi, he wants no special treatment. But why should the Government action be prevented, if he is no danger to us? from sleeping under the sky in this hot weather? Why should a felon not be given light to read or write if he needs it? May not a criminal read and instruct himself? And why should Sardar Vallabhbhai not have food that his health demands? But this is a matter of prison routine. Sardar Vallabhbhai is not the man whose spirit will be broken. If he does not get the necessary change, comfort. Did not the learned president and dominant author, Sri Khadijilal have similar treatment only the other day? The spirit of Swarajya will not be broken by steady treatment in the Indian prison. Only let those who have faith in the proposed conference know what Dushtinam Stasus is actually meant.

Unjust, any India, is preparing to vindicate the authority of the experts for which we represent the other Indians corresponding under the name of law. The authorities have imposed punishment in the name that the court will punish. Please keep them

will realize that his spirit will continue as long as his body in the midst of his peers. **M. K. G.**

P. S. Information has just been received that the Sardar is being better treated. He is to be allowed literature and the food he may need. **M. K. G.**

Begging the Question

"Dear Mr. Gandhi,

"His Excellency the Viceroy writes me to acknowledge your letter of the 2nd March. He regrets to learn that you contemplate a course of action which is clearly bound to involve violation of the law and danger to the public peace."

Yours very truly,
G. Cunningham
Private Secretary"

The reader is familiar with the reply. He will remember that it bears the signature, and I further information were needed, this suggested reply follows. On behalf since I asked for it and I have reported same instead.

It was over to the Viceroy to dismiss me by forcing the peasant's salt tax on which costs him two annas per year or nearly three day's income. I do not know outside India any one who pays to the same Rs. 3 per year. If he earns Rs. 300 during that period, it was given to the Viceroy to do many other things except compelling the usual ready. But the time is not yet. He requires a nation that does not easily give in, that does not easily repeat. Encracy never conquers it. It readily submits to physical force. It can witness with bare breath a boxing match for hours without fatigue. If you go mad over a foot ball match in which there may be broken bones. It uses later centuries over bloodbathing accounts of war. It will listen also to acute relentless suffering. It will not part with the millions it annually drains from India in reply to any argument, however convincing. The Viceroy's reply does not surprise me.

But I know that the salt tax has to go and many other things with it; if my letter means what it says. This alone can show how much of it was meant.

The reply says I contemplate a course of action which is clearly bound to involve violation of the law and danger to the public peace. In spite of the forest of books containing rules and regulations, the only law that the nation knows is the will of the British administrators, the only public peace the nation knows is the peace of a public prison. India is one vast prison house. I repudiate this law and regard it as my sacred duty to break the material monopoly of the compulsory power that is choking the heart of the nation for want of free vent. **M. K. G.**



